

70th Anniversary of Establishment of Diplomatic Relations between India and Japan in 2022 - Launch of India's Logo

January 04, 2022

2022માં ભારત અને જાપાન વચ્ચે રાજદ્વારી સંબંધોની સ્થાપનાની 70મી વર્ષગાંઠ - ભારતના લોગોનું લોન્ચિંગ

જાન્યુઆરી 04, 2022

1. ભારત અને જાપાને 28 એપ્રિલ 1952ના રોજ રાજદ્વારી સંબંધોની સ્થાપના કરી હતી. 2022માં બંને દેશો રાજદ્વારી સંબંધોની સ્થાપનાની 70મી વર્ષગાંઠની ઉજવણી કરશે. આ ઐતિહાસિક પ્રસંગને નિમિત્તે બંને દેશોએ ખાસ લોગો રાખવાનો નિર્ણય કર્યો છે. જાપાની પક્ષે આ વર્ષની શરૂઆતમાં તેનો લોગો લોન્ચ કર્યો હતો.

2. વિદેશ મંત્રાલય (એમઈએ) એ ભારતીય લોગો ડિઝાઇન કરવા માટે સપ્ટેમ્બર 2021માં લોગો ડિઝાઇન સ્પર્ધા શરૂ કરી હતી. MyGov (માયજીઓવી) પોર્ટલ દ્વારા લોકો પાસેથી એન્ટ્રી મંગાવવામાં આવી હતી. વિદેશ મંત્રાલયના બાહ્ય પ્રચાર વિભાગ દ્વારા અને ટોક્યોમાં ભારતીય દૂતાવાસ દ્વારા પણ તેની જાહેરાત કરવામાં આવી હતી. આ માટે કુલ 1131 એન્ટ્રીઓ મળી હતી. સ્ક્રિનિંગ કમિટીએ હરીફાઈના પરિમાણોના આધારે આ એન્ટ્રીઓનું મૂલ્યાંકન કર્યું અને પ્રથમ ઈનામ વિજેતા લોગો પસંદ કર્યો. વિજેતા લોગો ડિઝાઇન નીચે મુકવામાં આવ્યો છે.



3. લોગોમાં એક મોર અને એક લીલો તેતર દર્શાવવામાં આવ્યો છે, જે અનુક્રમે ભારત અને જાપાનના રાષ્ટ્રીય પક્ષીઓ છે. લીલો તેતર તેની પૂંછડી વડે અંક 7 બનાવે છે અને મોર અંક 0 બનાવે છે. લોગો બંને દેશો વચ્ચેના મિત્રતાના બંધનનું પ્રતીક છે. તે શ્રી અનુપ દેવ પુર્ટી દ્વારા બનાવવામાં આવ્યું છે. શ્રી પુર્ટીએ ગુજરાતની સરદાર પટેલ યુનિવર્સિટીમાં માસ્ટર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન (MCA) નો અભ્યાસ કર્યો છે. તેમની પાસે ઈ-લર્નિંગ, UI અને વેબસાઈટ ડિઝાઈનનો બહોળો અનુભવ છે.

4. 70મી વર્ષગાંઠની ઉજવણી કરવા માટે સમગ્ર વર્ષ દરમિયાન ભારત અને જાપાનમાં સંખ્યાબંધ કાર્યક્રમો યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં ભારત-જાપાન દ્વિપક્ષીય સંબંધોના વિવિધ ક્ષેત્રોને આવરી લેતી સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, પ્રદર્શનો અને પરિસંવાદોનો સમાવેશ થાય છે. આ ઈવેન્ટ્સ આ પ્રસંગને એવી રીતે ચિહ્નિત કરશે જે તેના મહત્વ વિશે અને ભારત-જાપાન વિશેષ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારીની સંપૂર્ણ સંભાવનાને સાકાર કરવા માટે તમામ હિતધારકોની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરશે.

નવી દિલ્હી
જાન્યુઆરી 04, 2021

DISCLAIMER: This is an approximate translation. The original is available in English on MEA's website and may be referred to as the official press release.